



## ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

## ਕੂਪਿ ਹਰਾਮਾਨ ਸੇਵ

## નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય

નવસારી - ૩૮૬૪૫૦, ગુજરાત

ઈ-મેઈલ:- [aasnavsari@gmail.com](mailto:aasnavsari@gmail.com)



(નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય અને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગદ્વારા પ્રસારિત)

તા. ૧૦/૦૫/૨૦૨૨

## કૃષિ હવામાન બુલેટીન નં : ૧૨/ ૨૦૨૨ - ૨૦૨૩

## -- નવસારી જિલ્લો --

પાછળનાં સમયનું હવામાન (તા. ૦૬ મે થી ૧૦ મે -૨૦૨૨)

અનું. નં.	હવામાન પરિબળો	Value
૧.	વરસાદની શ્રેણી (મી.મી.)	૦.૦
૨.	મહિનમની વરસાદની શ્રેણી (સે.ગ્રે.)	૩૫.૫-૪૦.૫
૩.	લઘુનામના વરસાદની શ્રેણી (સે.ગ્રે.)	૨૪.૫-૨૮.૫
૪.	ભેજના શ્રેણી (%)	૩૨-૬૯
૫.	પવનની ગતિની શ્રેણી (કિ.મી./કલાક)	૩.૧-૪.૪
૬.	વાદળની સ્થિતિની શ્રેણી (ઓક્ટા)	૦-૪
૭.	સુર્યપ્રકાશિત સમયની શ્રેણી (કલાક)	૫.૮-૧૦.૩
૮.	પાઇળના પાંચ દિવસમાં સંચિત વરસાદ (મી.મી.)	૦.૦
કુલ વરસાદ		૦.૦

આઈ. એમ. ડી. દ્વારા પ્રાપ્ત હવામાન આગાહી (તા ૧૧ મે થી ૧૫ મે - ૨૦૨૨)


અનું. નં.	હવામાન પરિબળો	દિવસ-૧ (૧૧/૦૫)	દિવસ-૨ (૧૨/૦૫)	દિવસ-૩ (૧૩/૦૫)	દિવસ-૪ (૧૪/૦૫)	દિવસ-૫ (૧૫/૦૫)
૧.	વરસાદ (મી.મી.)	૦	૦	૦	૦	૦
૨.	મહનમ તાપમાન (સે.ગ્રે.)	૩૮	૩૮	૩૯	૩૯	૩૯
૩.	લઘુનમ તાપમાન (સે.ગ્રે.)	૨૮	૨૮	૨૭	૨૭	૨૭
૪.	મહનમ ભેજ (%)	૭૬	૮૬	૮૪	૮૩	૮૨
૫.	લઘુનમ ભેજ (%)	૩૧	૩૫	૫૨	૫૭	૫૮
૬.	પવનની ગતિ (કિ.મી./કલાક)	૧૭	૨૧	૨૬	૨૮	૨૭
૭.	પવનની હિંદા (ક્રમાસ પોઈન્ટ)	૨૧૦	૨૩૮	૨૩૮	૨૩૮	૨૪૫
૮.	વાદળની સ્થિતિની (ઓક્ટા)	૬	૧	૬	૨	૨

<b>હવામાન સારાંશ / ચેતવણી</b>	<ul style="list-style-type: none"> <li>આઈ. એમ. ડી. , દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં આકાશ વાદળાણ્ય રહેશે અને વરસાટ પડવાની સંભાવના નથી.</li> <li>મહત્તમ તાપમાન ઉદ્ધ થી ઉદ્દ સે . જ્યારે લધુતમ તાપમાન ૨૭ થી ૨૮ સે. આસપાસ રહેવાની સંભાવના છે.</li> <li>હવામાન ભેજનું પ્રમાણ ૩૧ થી ૮૬ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે.</li> <li>પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૭ થી ૨૮ કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.</li> <li>વિસ્તૃત રેન્જની આગાહી મુજબ , સામાન્ય વરસાટ પડવાની શક્યતા નથી અને મહત્તમ તાપમાન અને લધુતમ તાપમાન ૨૧ મે, ૨૦૨૨ સુધી સામાન્ય (<math>38.48^{\circ}\text{S}</math> અને <math>26.93^{\circ}\text{E}</math>) રહેવાની શક્યતા છે.</li> </ul>
-----------------------------------	---

## -:: દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વિસ્તાર ::-

<p><b>સામાન્ય સલાહ</b></p> <ul style="list-style-type: none"> <li>કોરોના (કોવિડ-૧૯) રોગચાળાની મહામારીના લીધે, બેડૂત મિત્રોએ ખેતર પર જેતીની કામગીરી દરમ્યાન ખેત સાવધાનો/ઓજારો અને ખેત મજૂરો સાથે એકબીજાથી સામાજિક અંતર રાખવું અને તે માટેની સાવધાની અને સલામતી રાખવી તેમજ અગમ્યેતી જગવવી.</li> <li><b>જો પવનની ઝડપ ૧૫ કિમી પ્રતિ કલાક થી વધુ હોય તો દવા છાંટવાનું મુલતવી રાખવું.</b></li> <li>ખેતરની વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે નીદામણ, આંતરખેડ, પિયત, રસાયણિક ખાતર અને દવાનો છંટકાવ હવામાનની સિથિત મુજબ કરવાની સલાહ આપવામાં આવે છે.</li> <li>જમીનમાં ભેજનું જગવવા અને નીદામણ નિયંત્રણ માટે પાક અવશેષો, ભૂસું, પરાળ, અથવા પ્લાસ્ટિક આપરાણ નો ઉપયોગ કરવો.</li> <li>કૃપિ હવામાન સલાહકારી બુલેટીન અને હવામાનની આગાહી અંગેની માહિતી મેળવવાં માટે ડાઉનલોડ કરો મેધાદૂત મોબાઇલ એપ્લિકેશન, જે બેડૂતને તેમની સ્થાનિક ભાષામાં સ્થાન, પાક અને પશુથન વિશે હવામાનાધારિત કૃપિ સલાહ પ્રદાન કરશે. મેધાદૂત એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:</li> </ul> <p>એન્ડ્રોઈડ યુર્જર્સ: <a href="https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot">https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot</a></p> <p>આઈ.ઓ.એસ. યુર્જર્સ: <a href="https://apps.apple.com/in/app/meghdoot/id1474048155">https://apps.apple.com/in/app/meghdoot/id1474048155</a></p> <ul style="list-style-type: none"> <li>દામની મોબાઇલ એપ્લિકેશનદ્વારા આકાશીય વિજણીની અગાઉથી ચેતવણી આપવામાં આવે છે તેમજ આકાશીય વિજણીથી બચવા શું કરવું અને શું નહિ કરવું તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે છે. આથી બેડૂતમિત્રોને દામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે. દામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:</li> </ul> <p>એન્ડ્રોઈડ યુર્જર્સ: <a href="https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini">https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini</a></p> <p>આઈ.ઓ.એસ. યુર્જર્સ: <a href="https://apps.apple.com/app/id1502385645">https://apps.apple.com/app/id1502385645</a></p>
---

NOAA/VIIRS/BLENDED NDVI Composite ending on Week no 18  
(30.04.2022 to 06.05.2022) over Agricultural region



Agricultural vigour is moderate over the state.

પાક	હવામાન આધારિત કૃપિ સલાહ
શેરડી	<ul style="list-style-type: none"> <li>પૂરતી ખાતરની ભલામણ મુજબ નાઈટ્રોજન ખાતર આપવું –</li> <li>બીજો ડોઝ – ૨૫૦ કિગ્રા. નાઈટ્રોજન/લે. ના. ૩૦% મુજબ વાવણીના ૩ થી ૩.૫ માસ બાદ.</li> <li>ત્રીજો ડોઝ – ૨૫૦ કિગ્રા. નાઈટ્રોજન/લે. ના. ૨૦% મુજબ વાવણીના ૪ થી ૪.૫ માસ બાદ</li> <li>ચોથો ડોઝ – ૨૫૦ કિગ્રા. નાઈટ્રોજન/લે. ના. ૩૫% મુજબ વાવણીના ૫.૫ થી ૬ માસ બાદ (ભારે પાળા ચાડાવ્યા પહેલા).</li> <li>જમીન/વાતાવરણ અને પાકની અવસ્થા મુજબ જરૂરી પિયત આપવું. ઉનાળામાં - ૧૫-૧૭ દિવસના ગાળો પિયત આપવું અથવા ટપક પિયત અપનાવી અને બે હર વર્ષે સૂકી પતારીનું આવરણ (મલાંગિંગ) કરી પિયત પાવણીની બચત કરવી.</li> <li>પાકને વાવણીના ચાર માસ સુધી નીદામણ મુક્ત રાખવું, આ માટે સમયાંતરે આંતરખેડ અને હાથથી નીદામણ કરવું અથવા નીદામણનાશક દવા ૨ ,૪-D (૧.૨ કિગ્રા. સંક્રિયતત્વ/લે.) + પેરાકવોટ (૦.૬૦૦ કિગ્રા. સંક્રિયતત્વ/લે.) ૩૦-૬૦ દિવસ વર્ષે છંટકાવ કરવો.</li> <li>વાવણીના ૩-૩.૫ માસે અને ૫-૫.૫ માસે પાળા ચાડાવવા.</li> <li>શેરડીના પાકમાં દુંખના વધીકો માટે કાર્બોક્સ્યુરાન ઉછ્ચ ૩૩ કી.ગ્રા./લે. જમીનમાં આપવું</li> </ul>
ઉનાળું ડાંગર	<p><b>કૂટ અવસ્થા:</b></p> <ul style="list-style-type: none"> <li>ક્યારીમાં ૨-૩ સેમી. પાવણી ભરાય તે રીતે પિયત આપવું</li> <li>નાઈટ્રોજન ખાતરનો બીજો હપ્તો ૪૦ કિગ્રા. ના./લે. રોપણીના ૨૦-૨૫ દિવસ બાદ આપવો. ખાતર</li> </ul>

	<p>આપતા પહેલા ક્યારીમાંથી પાણી નિતારી હેવું અને ૧ દિવસ બાદ ફરી ભરવું.</p> <ul style="list-style-type: none"> <li>ડાંગરની ક્યારી નીદણ મુક્ત રાખવી. આ માટે હાથથી નીદણ કરવું અને પેડી વીડર ચલાવવું.</li> </ul>
ઉનાળુ કઠોળ	<ul style="list-style-type: none"> <li>પારવણી અને ખાલા પૂર્ણ વાવણીના ૧૫-૨૦ દિવસ બાદ કરવું.</li> <li>ઝેતરને વાવણીના ૪૫ દિવસ સુધી નીદણ મુક્ત રાખવું. આ માટે હાથથી નીદણ કરવું અને આંતર ખેડ કરવી.</li> <li>જમીન અને વાતાવરણ ધ્યાને રાખી પિયત આપવું.</li> </ul>
ભીડા	<ul style="list-style-type: none"> <li>જરૂરિયાત મુજબ આંતરખેડ અને નિંદામણ કરવી.</li> <li>પૂર્ણ ખાતર તરીકે ૫૦ કિલો પ્રતિ લેક્ટર પ્રમાણે નાઈટ્રોજન આપવું. (યુરિયા: ૧૦૮ કિલો પ્રતિ લેક્ટર)</li> <li>જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> <li>ભીડામાં પાન કથીરી ના નિયંત્રણ માટે ફેનાઓકવીન ૧૦ ઈસી અથવા પ્રોપગાઈટ ૫૭ ઈસી ૧૦ મિલી./૧૦ લીટર પાણીમાં ભેળવી પાક ઉપર છંટકાવ હવામાન ચોખ્ખુ હોય ત્યારે કરવો.</li> </ul>
ચોળી	<ul style="list-style-type: none"> <li>જરૂરિયાત મુજબ આંતરખેડ અને નિંદામણ કરવી.</li> <li>જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> </ul>
ગુવાર	<ul style="list-style-type: none"> <li>જરૂરિયાત મુજબ આંતરખેડ અને નિંદામણ કરવી.</li> <li>જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> </ul>
પરવળ	<ul style="list-style-type: none"> <li>જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> </ul>
ટિંડોળા	<ul style="list-style-type: none"> <li>જરૂરિયાત મુજબ પિયત આપવું.</li> </ul>
સુરણુ	<ul style="list-style-type: none"> <li>૦.૧ % કારબેદેજીમ સાથે ગાયના તાજ છાણની રબડીમાં કંદને બોળીને છાંયડામાં સુકવી પછી રોપણી કરવામાં આવે છે.</li> <li>ગાંધેને ૬૦ x ૬૦ સેમી. ના અંતરે રોપણી કરો.</li> <li>ખાડામાં ઉભા રોપી અને હવામાનની માહિતીને ધ્યાનમાં રાખી હળવું પાણી આપવું.</li> <li>દક્ષિણ ગુજરાતના ભારે વરસાદીય વિસ્તારમાં સેન્ટ્રીય જેતીથી સૂરણુની ગંજનદ્ર જાત ઉગાડવા માંગતા ખેડૂનોએ સજ્જવ જેતી ઉત્પાદિત ૫૦૦ ગ્રામ વજનનાં સૂરણુના ટૂકડાને લઈ તેને ૧-૨ કિલો લીમડાના ખોળ તથા બિયારણના ૧ કિલો વજન ટીછ ૫ ગ્રામ ટ્રાયકોર્ડર્મા હરજ્યાનમ ભેળવેલ ૧ ડોલ છાણની રબડીમાં માવજત આપી છાંયડામાં સુકવી વાવેતર કરવું.</li> <li>વાવેતર સમયે ઉદ ટન/લે. છાણિયા ખાતર : લીમડાનો ખોળ (૧૦:૧ નું પ્રમાણ) કે જેમાં ૨.૫ કિલો/ટન પ્રમાણે ભેળવેલ ટ્રાયકોર્ડર્મા હરજ્યાનમ મિશ્રણનો ઉપયોગ કરવો તથા સાથે સાથે ૧ ટન/ લેક્ટર લીમડાનો ખોળ પણ આપવો.</li> <li>સૂરણુના ખાડાની વર્ચ્યેની ખાલી જગ્યામાં ફરી પાછો ચોળીનો લીલો પડવાશ ૨૦ કિલો/લેક્ટર બિયારણ લઈ કરવો તથા ૪૫ થી ૬૦ દિવસોમાં તેને ખાડામાં દાબાવી દેવો તથા સાથે સાથે ૩ ટન/ લેક્ટર રાખ પણ આપવી.</li> </ul>
રતાળુ	<ul style="list-style-type: none"> <li>કંદના ટૂકડાને કલોરોપાયરીફોસ + બાવીસ્ટીન ની કંદ માવજત આપી છાયામાં સુકવ્યા બાદ રોપણી કરવી.</li> <li>ગાંધેને ૬૦ x ૬૦ સેમી. ના અંતરે રોપણી કરો.</li> <li>હવામાનની માહિતીને ધ્યાનમાં રાખી હળવું પાણી આપવું.</li> </ul>
તાનિયા	<ul style="list-style-type: none"> <li>ગાંધેને ૬૦ x ૬૦ સેમી. ના અંતરે રોપણી કરો.</li> <li>હવામાનની માહિતીને ધ્યાનમાં રાખી હળવું પાણી આપવું.</li> </ul>
અંબા	<p><b>સામાન્ય સલાહ:</b></p> <ul style="list-style-type: none"> <li>અંબાના મેઢની ઈયાળો થડમાંથી શોધીને મારી નાખો અને કાણાંની અંદર કલોરોપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મી.લી./૧૦ લી. દ્રાવણ નાંખી કાદવથી કાણાં બંધ કરી દેવા હવામાન ચોખ્ખુ હોય ત્યારે આપવું.</li> <li>કેરી વટાળા જેવડી થાય ત્યારે યુરિયા (૮૦૦ ગ્રામ) અથવા અમોનિયમ સલ્ફેટ (૧.૮ કિગ્રા) ખાતર આપવું.</li> <li>અંબાવાડીમાં કેરી વટાળા જેવડી થાય ત્યારે અને ૨૫ દિવસના આંતરે એમ બે દિવસ પિયત આપવું.</li> <li>કેરી વટાળા જેવડી થાય બાદ અન. એ. એ. (૨ ગ્રામ) + યુરિયા (૨ કિગ્રા.) અથવા નોવેલ ઓર્ગનિક લીકવીડ ન્યુટ્રિઅન્ટ (૧.૫ લી.) નાખી હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૨૫ દિવસ બાદ કરવો.</li> <li>અંબાની વાડીમાં ફણમાખીના નિયંત્રણ માટે ફણમાખીના પીજર (૧૦ ટ્રેપ/લે.) મૂકવા.</li> <li>કાલવણ રોગ તેમજ અન્ય રોગનાં નિયંત્રણ માટે કાર્બનેજીમ ૫૦ % વે.પા. ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.</li> </ul>

ચીકુ	<b>સામાન્ય સલાહ:</b> <ul style="list-style-type: none"> <li>• બીજા વિભાજનમાં ભવામણ કરેલ ખાતરનો ૨૫ ટકા ભાગ પ્રમાણે ચાસાયણિક ખાતર એમોનિયમ સંફેટ ૧.૩ કિગ્રા. અથવા યુરિયા ૦.૬ કિગ્રા., સિંગલ સુપર ફોર્સફેટ ૦.૮ કિગ્રા., સ્યુરેટ ઓફ પોટાશ ૦.૩ કિગ્રા., છાણિયુ ખાતર ૨૫ કિગ્રા. આ મહિનામાં હવામાન ચોખ્ખુ હોય ત્યારે આપવું.</li> <li>• ચીકુની વાડીમાં ફુળમાખીના નિયંત્રણ માટે ફુળમાખીના પીજર (૧૦ ટ્રેપ/લે.) મુકવા.</li> </ul>
પશુપાલન	<b>સામાન્ય સલાહ:</b> <ul style="list-style-type: none"> <li>• પશુઓને દૂધ ઉત્પાદન અને નિભાવની જરૂરિયાત ધ્યાનમાં લઈ પૂરતા પ્રમાણમા સમનોલ આહાર આપવો. તેમજ પશુઓના રહેઠાણ ચોખ્ખા રાખવા, દિવસ દરમયાન સમયાંતરે મળ-મૂતર નો નિકાલ કરવો.</li> <li>• પશુઓને ઉચ્ચ ગુણવત્તાવાળું ખનીજક્ષાર મિશ્રણ દૈનિક આપવું જોઈએ. જેની માત્રા પશુચિકિત્સક સલાહ મુજબ અથવા તેનું પેંકિંગ પરના નિર્દશાનુસાર આપવાનો રહે છે.</li> <li>• પશુઓને યોગ્ય આહારમા જરૂરીયાત પ્રમાણે ખનીજયુક્ત મિશ્રણના સમાવેશ કરવો જોઈએ.</li> <li>• ચાદ્દ કટરથી લીલા તથા સૂક્ષ્મ ઘાસચારાને ટુકડા કરીને જ નીરણ કરવું.</li> <li>• દૃધાળું પશુઓના આઉને દૂધ દોહન પહેલા અને પછી ઝીક ઓક્સાઈડ અથવા બોરીક પાઉડર અથવા પોટેશીયમ પરમેગેનેટ ના ટ્રાવણીથી બરાબર સાંદ્ર કરવા.</li> <li>• પશુઓનાં ઈતરદીના નિયંત્રણ માટે ડેલ્ટામેથીન અથવા એમીટાઇર ૨ મી.લી./લિટર પાણીમાં નાખને છાંટવી (દવાની બોટલ ઉપર લખેલી સૂચનાનો અમલ કરવો).</li> <li>• પશુઓ જ્યારે ઈચ્છે ત્યારે પાણી પી શકે નેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અથવા ઓછામાં ઓછુ દિવસમાં ચારથી પાંચ વાગત જરૂરીયાત મુજબ પાણી પીવડાવવું જોઈએ.</li> <li>• કોઢ/ગમાણની ઉચ્ચાઈ ૧૦ કુટથી વધારે રાખવી, જેથી હવાની હેરફેર સરળતાથી થઈ શકે, બફારો/ગરમી ઓછી થાય અને ભોયાનગિયાનો ભાગ સુકો રહે.</li> <li>• વિયાળ બાદ વાધરડા/પાડીયાને અડ્વાથી એક કલાકની અંદર ૫૦૦ મી.લી. જેટલું ચીક / ઝીરં પીવડાવવું ત્યારબાદ પંદર દિવસ સુધી વધરડા/પાડીયાં કુલ વજન ના ૧૦ માં ભાગનું દૂધ/દિવસ પીવડાવવું.</li> <li>• ગરમીની ઋતુમાં પશુઓનું શારીરિક તાપમાન જગવાય રહે તે માટે કોઢ/ગમાણમાં પંખાની વ્યવસ્થા કરવી અથવા બાપોરના સમયમાં વૃક્ષના છાયડામાં રાખી શકાય.</li> </ul>
વનીકરણ	<b>કૃષિ વનીકરણ: વાવેતર:</b> <ul style="list-style-type: none"> <li>• પ્રથમ બને બીજા વર્ષના વાવેતર દરમયાનમાં નિદશ અને સફાય કરવી જોઈએ.</li> </ul>
ઝીશરીઝ	<b>સામાન્ય સલાહ:</b> <ul style="list-style-type: none"> <li>• મીઠા પાણીના મ ત્સય મીઠા પાણીના જુંગા ઉત્પાદન કરતા ઐઝૂને જણાવવાનું કે, આ સમયગાળા દરમયાન પૂર્તી માત્રામાં ખોરાક આપવોકારણ કે આ વાતાવરણ માછલી/મીઠા પાણીના જુંગા માટે અનુકૂળ છે.</li> <li>• તળાવમાં પાણીનું લેવલ જાળવવું અને વધુ વરસાદ આવે ત્યારે તળાવના આઉટલેટ થોડી માત્રામાં ખોલવા તેથી પાણીનું લેવલ જણવાયેલું રહે.</li> <li>• તળાવના તળિયાનું અને સપાઈનું તાપમાન સરખર કરવા એરેટર અથવા પંખ્ય ચલાવવા.</li> </ul>

#### ❖ એન્ગ્રોમેટ સલાહકાર સેવા બુલેટીન કમિટીના સભ્યો :

- ડૉ. એચ. એમ. વિરદીયા, સંશોધન વૈજ્ઞાનિક (સથય વિજ્ઞાન)
- ડૉ. એલ. વી. વેટીયા, સહ પ્રાધ્યાપક (વનસ્પતિ કીટકશાસ્ત્ર)
- ડૉ. કે. બી. રાખોલીયા, સહ પ્રાધ્યાપક (વનસ્પતિ રોગશાસ્ત્ર)
- ડૉ. સી. જી. ઈટવાલા, સંશોધન વૈજ્ઞાનિક (શાકભાજ વિજ્ઞાન)
- ડૉ. વાય. એન. ટેલે, સહ પ્રાધ્યાપક (દૃષ્ટિ વિજ્ઞાન)
- ડૉ. વી. આર. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક (પશુપાલન)
- ડૉ. હિલેશ્વર નાયક, મદદનીશ પ્રાધ્યાપક (વનીકરણ)
- ડૉ. એમ. આર. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક (ઝીશરીઝ સાયન્સ)
- ડૉ. વિભા ટાક, રીસર્ચ એસોસીયેટ (જી.કે.એમ.એસ.)
- ડૉ. પી. કે. પરમાર, મદદનીશ પ્રાધ્યાપક (કૃષિ હવામાનશાસ્ત્ર) અને પ્રિન્સિપાલ નોડલ ઓફિસર (જી.કે.એમ.એસ.)



# Gramin Krishi Mausam Sewa

Agricultural Meteorological Cell  
Navsari Agricultural University  
Navsari - 396450, Gujarat  
E-mail :- aasnavsari@gmail.com



(Jointly issued by Navsari Agricultural University & India Meteorological Department)

**DATE OF ISSUE: 10/05/2022**

## Agromet Advisory Bulletin No: 12/2022 - 2023

### -- Navsari District --

#### Weather summary of preceding week 06 May to 10 May - 2022

Sr. No.	Name of Weather Parameters	Value
1.	Range of Rainfall (mm)	0.0
2.	Range of Maximum Temperature (°C)	35.5-40.5
3.	Range of Minimum Temperature (°C)	24.5-28.5
4.	Range of Relative Humidity (%)	32-96
5.	Range of Wind Speed (km/hr)	3.1-4.4
6.	Range of Cloud Cover (Okta)	0-4
7.	Range of bright sunshine hours (hrs)	6.8-10.3
8.	Last five days cumulative rainfall (mm)	0.0
<b>Total Rainfall (mm)</b>		<b>0.0</b>

#### IMD based Weather forecast for 11 May to 15 May - 2022


Sr. No.	Weathers Parameters	Day - 1 (11/05)	Day - 2 (12/05)	Day - 3 (13/05)	Day - 4 (14/05)	Day - 5 (15/05)
1.	Rainfall (mm)	0	0	0	0	0
2.	Maximum temperature (°C)	39	38	36	36	36
3.	Minimum Temperature (°C)	29	28	27	27	27
4.	Max. Relative Humidity (%)	79	86	84	83	82
5.	Min. Relative Humidity (%)	31	35	52	57	59
6.	Wind Speed (km/hr.)	17	21	26	28	27
7.	Wind Direction (Compass point)	210	238	238	238	246
8.	Total Cloud Cover (Okta)	6	1	6	2	2

<b>Weather Summary/ Alert</b>	<ul style="list-style-type: none"> <li>As per IMD weather forecasts over the next five days, the sky will be cloudy and there is chance no rainfall.</li> <li>The Maximum temperature 36 to 39 °C, when the Minimum temperature is 27 to 29 °C. likely to be around.</li> <li>The humidity in the air is likely to be between 31 and 86 percent.</li> <li>The wind direction will be South-West with an average speed of 17 to 28 km/h.</li> <li>As per Extended range forecast, possibility of no rainfall and maximum temperature and minimum temperature likely to remain normal 38.48 °C and 26.13 °C upto 21<sup>st</sup> May, 2022.</li> </ul>
-----------------------------------	--

## -:: South Gujarat Heavy Rainfall Zone ::-

<b>General Advisory</b> <ul style="list-style-type: none"> <li>• Due to pandemic of CORONA (COVID-19), Farmers should maintain social distancing and safety precaution while handling farm machines and labour in the field.</li> <li>• <b>If wind speed is high &gt;15 kmph, so avoid spraying of pesticide.</b></li> <li>• To carryout Interculturing, weeding, spraying chemical and applying fertilizer in sown crops and also Irrigation as per the weather condition.</li> <li>• Use crop residue, straw, plastic mulch for conservation of soil moisture and weed control.</li> <li>• Download the MEGHDOOT mobile application for Agromet Advisory Services and information on weather forecasting, which will provide weather based agricultural advice to farmers for their location, crops and livestock in their local language. Click on the following link to download the MEGHDOOT application: Android users: <a href="https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot">https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot</a> IOS users:<a href="https://apps.apple.com/in/app/meghdoot/id1474048155">https://apps.apple.com/in/app/meghdoot/id1474048155</a></li> <li>• Download the DAMINI Mobile application to ensure the safety through monitoring sky lightning activity. It will provide the alert and detail description of instruction, precaution, Do and Don't. Click on the following link to download the DAMINI application. Android users: <a href="https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini">https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini</a> IOS users:<a href="https://apps.apple.com/app/id1502385645">https://apps.apple.com/app/id1502385645</a></li> </ul>
--

NOAA/VIIRS/BLENDED NDVI Composite ending on Week no 18  
(30.04.2022 to 06.05.2022) over Agricultural region



Agricultural vigour is moderate over the state.

Crop	Weather based Agro-Advisory
<b>Sugarcane</b>	<ul style="list-style-type: none"> <li>• Apply split dose of Nitrogen fertilizer as per recommendation- 2<sup>nd</sup> dose 30% of 250 kg N/ha at 3-3.5 month after planting, 3<sup>rd</sup> dose 20% of 250 kg N/ha at 4-4.5 month after planting and 4<sup>th</sup> dose 35% of 250 kg N/ha at 5.5-6 month after planting (before final earthing up).</li> <li>• As per soil/climatic condition and stage of crop irrigation apply- summer at 15-17 day interval or adopt drip method of irrigation and mulching of trash in between two rows of crop to save irrigation water.</li> <li>• Keep crop weed free upto 4 months of planting by interculturing, hand weeding or apply post emergence weedicide like 2,4-D (1.2 kg ai/ha)+ <i>Paraquat</i> (0.600 kg ai/ha) after 30-60 DAP.</li> <li>• Earthing up should be done at 3-3.5 and 5.5-6 months after planting.</li> <li>• Application of <i>Carbofuron</i> 3G @ 33 kg/hac. in soil for control of sugarcane shoot borer.</li> </ul>
<b>Summer Paddy</b>	<p><b>Tillering stage:</b></p> <ul style="list-style-type: none"> <li>• Keep 2-3 cm standing water in transplanted field.</li> <li>• Apply recommended split dose of Nitrogen (20 kg/ha.) at 20-25 days after transplanting. Before application of fertilizer drain water from field and apply 1 day after.</li> </ul>

	<ul style="list-style-type: none"> <li>Keep weedfree the field by hand weeding interculturing with paddy weeder.</li> </ul>
<b>Summer Pulse crop</b>	<p><b>Land preparation /Sowing :</b></p> <ul style="list-style-type: none"> <li>Thinning and gap filling should be done to maintain plant population at 15-20 days after sowing.</li> <li>Keep field weed free by hand weeding and interculturing up to 45 days after sowing.</li> <li>Apply irrigation as per the need, consider climate and soil type.</li> </ul>
<b>Okra</b>	<ul style="list-style-type: none"> <li>Interculturing &amp; weeding should be carried out.</li> <li>Apply top dressing of Nitrogen i.e., 50 kg/ha (Urea: 109 kg/ha)</li> <li>Apply irrigation as per need.</li> <li>Spraying of <i>Fenazaquin</i> 10 EC or <i>Propargite</i> 57 EC @ 10 ml./10 Lit. of water for red Spider Mite for Okra crop during clear weather condition.</li> </ul>
<b>Cow Pea</b>	<ul style="list-style-type: none"> <li>Interculturing &amp; weeding should be carried out.</li> <li>Apply irrigation as per need.</li> </ul>
<b>Cluster bean</b>	<ul style="list-style-type: none"> <li>Interculturing &amp; weeding should be carried out.</li> <li>Apply irrigation as per need.</li> </ul>
<b>Pointed gourd</b>	<ul style="list-style-type: none"> <li>Apply irrigation as per requirement.</li> </ul>
<b>Little gourd</b>	<ul style="list-style-type: none"> <li>Apply irrigation as per requirement.</li> </ul>
<b>Elephant foot yam</b>	<ul style="list-style-type: none"> <li>Treat the corm seed with 0.1 % <i>Carbendazim</i> + fresh thick cow dung slurry, dry it and burry it vertically in the pits.</li> <li>Planting the corm seed at the spacing of 90 x 90 cm.</li> <li>Give light irrigation considering the weather information.</li> <li>The farmers of south Gujarat Heavy Rainfall Zone, intending to grow elephant foot yam cv. Gajendra organically are advised to take organically produced planting material of 500 g weight and treat it with bucket full of cow dung slurry containing 1- 2 kg neem cake and <i>Trichoderma harzianum</i> (5 g per kg seed corm) and then dry under shade before planting.</li> <li>At the time of planting, apply FYM : neem cake mixture (in 10:1 ratio) @ 36 t ha<sup>-1</sup> incorporated with <i>Trichoderma harzianum</i> @ 2.5 kg per tonne of FYM neem cake mixture along with neem cake @ 1 t ha<sup>-1</sup> in pits.</li> <li>Raise green manure cowpea again with 20 kg ha<sup>-1</sup> seed rate in-between fallow space of elephant foot yam plants and incorporate at 45-60 days in pits along with 3 t ha<sup>-1</sup> of ash.</li> </ul>
<b>Greater yam</b>	<ul style="list-style-type: none"> <li>Treat the tuber seed with <i>Chlorpyrifos</i> + <i>Bavistin</i> and dry in shade, then planting should be done.</li> <li>Planting the corm seed at the spacing of 90 x 90 cm.</li> <li>Give light irrigation considering the weather information.</li> </ul>
<b>Tannia</b>	<ul style="list-style-type: none"> <li>Planting the corm seed at the spacing of 90 x 90 cm.</li> <li>Give light irrigation considering the weather information.</li> </ul>
<b>Mango</b>	<p><b>General Advise :</b></p> <ul style="list-style-type: none"> <li>Find grubs of stem borer from gallery and holes on the stem and kill them. Do pouring of <i>Chlorpyrifos</i> 20 EC @ 25 ml/ 10 lit. in hole and plug it with mud in clear weather condition.</li> <li>Give fertilizer Urea @ 800 g or Ammonium Sulphate @ 1.8 kg at pea stage of fruit.</li> <li>Give two irrigations at pea stage of fruit and followed by 25 days of first irrigation.</li> <li>Two foliar spray of NAA (2 g) + Urea (2 kg) or 1.5 % Novel organic liquid nutrient (1.5 lit.) of 100 Lit. water at pea stage of fruit and 25 days after first spray in clear weather condition.</li> <li>Install <i>Methyl Eugenol</i> trap (10 traps/ha.) for controlling <i>Fruit Flies</i> in mango orchard.</li> <li>Spraying of <i>Carbendazim</i> 50 WP @ 10 g/10 lit. water for control of</li> </ul>

	Anthracnose disease during clear weather condition.
Sapota	<p><b>General Advise :</b></p> <ul style="list-style-type: none"> <li>• Apply second split of 25% of RDF (<i>Ammonium Sulphate</i> -1.3 kg or <i>Urea</i> 0.6 kg, <i>SSP</i> 0.8 kg and <i>MOP</i> 0.3 kg + <i>FYM</i> 25 kg each tree) in clear weather condition.</li> <li>• Install <i>Methyl Eugenol</i> trap (10 traps/ha.) for controlling <i>Fruit Flies</i> in sapota orchard.</li> </ul>
Livestock	<p><b>General Advise :</b></p> <ul style="list-style-type: none"> <li>• Provide adequate quantity of balanced ration by considering the milk production and maintenance.</li> <li>• All the livestock should provided with good quality of mineral mixture, for that dose rate are as per the prescription label on the packing or as guided by veterinary doctor.</li> <li>• Good quality dry roughage with 15-20 kg green fodder provided to the animals, only after chaffing.</li> <li>• Feed silage &amp; hay materials if available.</li> <li>• Before and after milking udder must be properly clean with zinc oxide or boric powder or potassium permanganate solutions.</li> <li>• For the control of tick and other parasites, spray <i>Deltemethrin</i> or <i>Aemitaz</i> 2 ml in 1 liter of water.</li> <li>• Height of animal shed should keep minimum 10 feet for aeration to maintain the floor dry and to control humidity.</li> <li>• Young calves should be offered with approximate 500 ml. of Colostrums within half an hour of calving. Thereafter for next 15 days, milk should be offered at the amount of 1/10<sup>th</sup> of body weight in a day.</li> <li>• In the summer season, to maintain the body temperature, it is advisable that to keep fan in the shade or can keep the animal under the shadow of the tee.</li> </ul>
Forestry	<p><b>Agro Forestry : Plantations :</b></p> <ul style="list-style-type: none"> <li>• Weeding and cleaning should be done during first and second year plantations.</li> </ul>
Fisheries	<p><b>General Advise :</b></p> <ul style="list-style-type: none"> <li>• Fresh water farmers give proper feed in fish/prawn farming for better growth rate because environment condition is very suitable.</li> <li>• Increase water depth and maintain water level through pond outlet.</li> <li>• Mixing the top and bottom water by using the aerators or pumps.</li> </ul>

❖ **Members of Agro-Advisory Committee :**

- Dr. H. M. Viradia, Research Scientist (Agronomy)
- Dr. L. V. Ghetiya, Associate Professor (Entomology)
- Dr. K. B. Rakholiya, Associate Professor (Plant Pathology):
- Dr. C. G. Intwala, Research Scientist (Vegetable Science)
- Dr. Y. N. Tandel, Associate Professor (Fruit Science)
- Dr. V. R. Patel, Assistant Professor (Animal Husbandry)
- Dr. Dileswar Nayak, Assistant Professor (Forestry)
- Dr. M. R. Patel, Assistant Professor (Fisheries Science)
- Dr. Vibha Tak, Research Associate(GKMS)
- Dr. P. K. Parmar, Assistant Professor (Agricultural Meteorology and Principal Nodal Officer (GKMS))

## હવામાન આગાહી

વિગત	તારીખ	ડાંગ	નવસારી	વલસાડ
વરસાદ (મી.મી.)	૧૧/૦૫/૨૦૨૨	૦	૦	૦
	૧૨/૦૫/૨૦૨૨	૦	૦	૦
	૧૩/૦૫/૨૦૨૨	૦	૦	૦
	૧૪/૦૫/૨૦૨૨	૦	૦	૦
	૧૫/૦૫/૨૦૨૨	૦	૦	૦
મહત્તમ તાપમાન (સે.ગ્રે.)	૧૧/૦૫/૨૦૨૨	૩૬	૩૬	૩૬
	૧૨/૦૫/૨૦૨૨	૩૮	૩૮	૩૮
	૧૩/૦૫/૨૦૨૨	૩૯	૩૯	૩૯
	૧૪/૦૫/૨૦૨૨	૩૯	૩૯	૩૯
	૧૫/૦૫/૨૦૨૨	૩૯	૩૯	૩૯
લઘુતમ તાપમાન (સે.ગ્રે.)	૧૧/૦૫/૨૦૨૨	૨૬	૨૬	૨૬
	૧૨/૦૫/૨૦૨૨	૨૮	૨૮	૨૮
	૧૩/૦૫/૨૦૨૨	૨૭	૨૭	૨૭
	૧૪/૦૫/૨૦૨૨	૨૭	૨૭	૨૭
	૧૫/૦૫/૨૦૨૨	૨૭	૨૭	૨૭
મહત્તમ ભેજ (%)	૧૧/૦૫/૨૦૨૨	૫૫	૭૬	૮૦
	૧૨/૦૫/૨૦૨૨	૮૧	૮૯	૮૫
	૧૩/૦૫/૨૦૨૨	૮૪	૮૪	૮૪
	૧૪/૦૫/૨૦૨૨	૮૪	૮૩	૮૨
	૧૫/૦૫/૨૦૨૨	૮૪	૮૨	૮૨
લઘુતમ ભેજ (%)	૧૧/૦૫/૨૦૨૨	૨૬	૩૧	૩૪
	૧૨/૦૫/૨૦૨૨	૨૪	૩૫	૩૯
	૧૩/૦૫/૨૦૨૨	૨૬	૫૨	૫૧
	૧૪/૦૫/૨૦૨૨	૨૭	૫૭	૫૨
	૧૫/૦૫/૨૦૨૨	૩૩	૫૬	૫૩
પ્રણની ગતિ(ક્રિ.મી./કલાક)	૧૧/૦૫/૨૦૨૨	૧૫.૪	૧૭.૧	૧૪.૮
	૧૨/૦૫/૨૦૨૨	૧૬.૨	૨૦.૮	૧૮
	૧૩/૦૫/૨૦૨૨	૨૩.૯	૨૫.૮	૨૨.૧
	૧૪/૦૫/૨૦૨૨	૨૯.૭	૨૮.૧	૨૩.૬
	૧૫/૦૫/૨૦૨૨	૨૪	૨૯.૩	૨૩.૩
પ્રણની દિશા (ક્રમાસ પોઈન્ટ)	૧૧/૦૫/૨૦૨૨	W	SW	SW
	૧૨/૦૫/૨૦૨૨	W	SW	SW
	૧૩/૦૫/૨૦૨૨	W	SW	SW
	૧૪/૦૫/૨૦૨૨	W	SW	SW
	૧૫/૦૫/૨૦૨૨	W	SW	SW
વાણની સ્થિતિની (ઓક્ટા)	૧૧/૦૫/૨૦૨૨	૬	૬	૬
	૧૨/૦૫/૨૦૨૨	૧	૧	૨
	૧૩/૦૫/૨૦૨૨	૫	૬	૭
	૧૪/૦૫/૨૦૨૨	૧	૨	૨
	૧૫/૦૫/૨૦૨૨	૧	૨	૨